

ઓફિસ પરોક્ષ ખર્ચા; કુલ પડતરના ૨૦% (જેમાં ૮૦% સ્થિર છે)  
 વેચાણ પરોક્ષ ખર્ચા; કુલ પડતરના ૧૦% (જેમાં ૬૦% ચલિત છે)  
કારખાનાના પરોક્ષ ખર્ચા:

સ્થિર ૪૮%

ચલિત ૩૨% (જે પ્રાથમિક પડતરના ૧૦% છે)

અર્ધચલિત ૨૦%

માલસામાન અને મજૂરીનું પ્રમાણ ૩:૨ નું છે. કારખાનાનાં અર્ધચલિત પરોક્ષ ખર્ચ ૮૦% ઉત્પાદન સપ્લાટી સુધી ૫૦% વધે છે અને ત્યાર બાદ તેમાં ૧૦૦% વધારો થાય છે. એકમદીઠ વેચાણ કિંમત એકસરખી રહે છે.

પ્રશ્ન:૩ જેઠાલાલ કંપની લિમિટેડની નીચેની માહિતી મળી છે;

(૧૫)

વર્ષ	વેચાણ રૂ.	નફો રૂ.
૨૦૧૭	૨,૦૦,૦૦૦	-૧૫,૦૦૦ (ખોટ)
૨૦૧૮	૩,૦૦,૦૦૦	૨૫,૦૦૦ (નફો)

ઉપરની વિગતો પરથી નીચેની ગણતરી કરો;

- |  |                                       |
|--|---------------------------------------|
| (૧) નફા-જથ્થા ગુણોત્તર                   | (૨) સ્થિર ખર્ચા                       |
| (૩) ૨૦૧૮ ના ચલિત ખર્ચા                   | (૪) સમતૂટ બિંદુ (રૂપિયામાં)           |
| (૫) રૂ. ૪,૦૦,૦૦૦ ના વેચાણે નફો           | (૬) રૂ. ૫,૦૦૦ ની ખોટ હોય ત્યારે વેચાણ |
| (૭) રૂ. ૩,૦૦,૦૦૦ ના વેચાણે સલામતીનો ગાળો |                                       |

અથવા

પ્રશ્ન:૩ નીચેના દાખલા ગણો.

(૧૫)

- |     |                          |              |
|-----|--------------------------|--------------|
| (૧) | ઉત્પાદન                  | ૮૦,૦૦૦ એકમો  |
|     | સ્થિર પડતર               | રૂ. ૪,૦૦,૦૦૦ |
|     | વેચાણ કિંમત એકમદીઠ       | રૂ. ૨૦       |
|     | ચલિત પડતર એકમદીઠ         | રૂ. ૧૦       |
|     | સમતૂટ બિંદુએ વેચાણ શોધો. |              |
| (૨) | સીમાંત પડતર              | રૂ. ૨,૪૦૦    |
|     | નફા-જથ્થા ગુણોત્તર       | ૨૦%          |
|     | વેચાણ કિંમત શોધો.        |              |
| (૩) | નફો                      | રૂ. ૨૦,૦૦૦   |
|     | નફા-જથ્થા ગુણોત્તર       | ૪૦%          |
|     | સલામતીનો ગાળો શોધો.      |              |

પ્રશ્ન:૪ એક કેમિકલના એક ટન માટે પ્રમાણિત મિશ્રણ અંગેની વિગતો નીચે મુજબ છે.

(૧૫)

કેમિકલ	વપરાશ (કિ.ગ્રા.)	કિલોદીઠ પડતર (રૂ.)
અ	૨૪૦	૬
બ	૪૦૦	૧૨
ક	૬૪૦	૧૦